



## પ્રકરણ - ૨૫

## સ્ત્રીઓનું કામ અને સ્વાસ્થ્ય



### વિષયસૂચિ :

- ૧.૦ રસોઈમાં વપરાતું બળતણા અને ઘૂમાડો
- ૨.૦ ભારે વજન ઉચ્કવું અને લઇ જવું
- ૩.૦ પાણી સાથે કામ કરવું
- ૪.૦ રસાયણો સાથે કામ કરવું
- ૫.૦ લાંબો સમય બેસી રહેવું કે ઉભા રહેવું
- ૬.૦ એક જ પ્રકારનું હલન-ચલન વારંવાર કર્યા કરવું
- ૭.૦ ગૃહેધોગ કરતી બેનો
- ૮.૦ કામની અસલામત પરિસ્થિતિ
- ૯.૦ જાતીય સત્તામણી
- ૧૦.૦ સ્થળાંતર
- ૧૧.૦ ભૂલી જવાયેલા શ્રમિક બેનો
- ૧૨.૦ પરિવર્તન માટે પ્રચાસ
- ૧૩.૦ કામ કરતી સ્ત્રીઓને રક્ષણ આપતા ફાયદા

## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

લગભગ દ્વેક સ્ત્રીનું મોટા ભાગનું જીવન કામ કરવામાં જ વીતે છે. સ્ત્રીઓ ખેતીકામ, રસોઈ, પાણી અને લાકડા લઈ આવવાં, બાળકો અને કુટુંબની સાર-સંભાળ વિગેરે કામો કરે છે. કેટલીક સ્ત્રીઓ તો કુટુંબને આર્થિક ટેકો કરવા બહાર કામ કરવા પણ જય છે. તો કેટલીક બહેનો કૌટુંબિક કામ માટે મજૂર અથવા કામવાળાનો પગાર ના આપવો પડે અને પૈસાની બચત થાય તે માટે મહેનતના કામો જતે ઉપાડે છે. છતાં સ્ત્રીઓનાં કામની બરાબર નોંધ લેવાતી નથી કારણકે તે પુરુષોના કામ જેટલું મહત્વનું ગણાતું નથી. સ્ત્રીઓ જે પ્રકારનાં અને જે પરિસ્થિતિમાં કામ કરે છે તેમાંથી સ્વાસ્થ્યના પ્રશ્નો ઉભા થાય છે. આ પ્રકારણમાં આવી કેટલીક સમસ્યાઓ, તેનાં કારણો તથા ઉપાયોનું વર્ણન કર્યું છે. પણ જ્યાં સુધી સ્ત્રીઓના કામની પરિસ્થિતિ બદલાય નહીં અને સ્ત્રીઓ કરે છે તે કામો અંગે આદર રખાય નહીં ત્યાં સુધી તેનો સાચો ઉકલ આવે નહીં. સૌચે લેગા મળીને પરિવર્તન માટે પ્રયત્નો કરવા જેઠાએ.

સ્ત્રી જ્યારે કુટુંબ સાચવવાનું અને કુટુંબ માટે પૈસા કમાવાનું કામ કરે છે ત્યારે ખરેખર તો તે બે નોકરી કરે છે. આ અને બાળજન્મ તથા બાળઉછેરનું કામ મળી સ્ત્રીઓ બે નહીં પણ ત્રણ-ત્રણ નોકરી કરે છે એમ કહી શકાય.



અર્થોપાર્જન માટે કેટલીક સ્ત્રીઓ જ્યારે વેશ્યાપ્રવૃત્તિમાં જેડાય ત્યારે તેની સાથે સ્વાસ્થ્યના કેટલાક ચોક્કસ અને ગંભીર જોખમો સંકળાયેલાં હોય છે. આ માટે અલગ પ્રકારણ અમે બનાવ્યું છે.

સ્વાસ્થ્ય કાર્યકરો અને બિજલ લોકો જ્યારે માંદા માણસો સાથે કામ કરે છે ત્યારે તેમને માંદા પડવાની સંભાવના છે આ સમસ્યાઓને રોકવાની ચર્ચા પણ સામાન્ય સ્વાસ્થ્ય સંભાળના પ્રકારણમાં કરી છે.

### ૧.૦ રસોઈમાં વપરાતું બળતણ અને ધૂમાડો

મોટાભાગની સ્ત્રીઓ દિવસનો મોટો ભાગ રાંધવામાં ગાળે છે. તેમને બળતણની આગ અને ધૂમાડાથી થતા સ્વાસ્થ્યના પ્રશ્નો ઉભા થાય છે. ધૂમાડાની નજીકમાં રમ્યા કરતા બાળકોને શરદી, ખાંસી, ન્યુમોનીઅંદ્રા અને ફેફસાંના ચેપોનું જોખમ વધે છે.

આગ :

કેરોસીન, અન્ય પ્રવાહી કે ગેસથી ધડાકા થાય છે, આગ લાગે છે કે દાકી જવાય છે. માટે આ બળતણને સાવચેતીપૂર્વક વાપરવા. તે માટે નીચે જણાવેલી કાળજી લેવી જોઈએ.

- \* આ બળતણ ચામડી પર ન પડે એની કાળજી રાખો અને જે પડે તો તરત જ ઘોંઠ નાંખો.
- \* બળતણને ચૂલાથી દૂર રાખો અને ત્યાં સીગરેટ કે ડિવાસળી સળગાવશો નહીં.
- \* હવા છૂટથી આવે એવી જગ્યાએ ચૂલો રાખો.
- \* ચૂલો પેટાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે કેરોસીન કે ગેસ આજુભાજુ ફેલાય નહીં.

રસોડામાં હવાની અવર જ વર હોવી અત્યંત જરૂરી છે.

ધૂમાડો :



લાકડાં, છાણાં, કોલસા, કરાંઠી અથવા હુંડા જેવા ખૂબ ધૂમાડો કરે એવા બળતણ વપરાય ત્યારે ધર અંધારિયું બને. એમાંય જ્યારે હવા-ઉલ્સ વગરના અંધારા ઓરડામાં રસોડું હોય ત્યારે મુશ્કેલી વધે છે. ધાસ કે કરાંઠી જેવા બળતણમાં જે એતીમાં વપરાતાં રસાયણો રહી ગયાં હોય તો તેનો ધૂમાડો વધારે નુકશાન કરે છે. આ ધૂમાડો શાસમાં જય ત્યારે કાયમી શરદી, ખાંસી, ન્યુમોનીઆ, દમ, ફેફસાંના ચેપ અને તેના રોગો ધર કરી જય છે. કોલસાનો ધૂમાડો ફેફસાં, મોં કે ગળાનું કેન્સર પણ કરી શકે.

સગભર્ય સીને ધૂમાડાથી નબળાઈ, ઉબકા, ચક્કર અને માથાનો દુઃખાવો જેવાં દરદો થાય છે. આ અવસ્થામાં તેની પ્રતિકાર શક્તિ ઓછી હોવાથી ફેફસાની બિમારીઓ સહેલાઈથી લાગે છે. તેના ગર્ભમાં રહેલ બાળકનો વિકાસ ધીમો રહે, જન્મ સમયે વજન ઓછું હોય અથવા બાળક અધૂરા માસે જન્મે.

પુડુષો કરતાં સ્ત્રીઓને ધૂમાડાનું જેખમ વધારે હોય છે કેમકે સ્ત્રીઓ વધારે સમય ધૂમાડો શાસમાં લે છે.

ધૂમાડામાંથી ઉલ્લી થતી સમસ્યાઓ અટકાવવી :

ઘરની અંદર ધૂમાડાવાળી હવા ઓછી કરવા માટે

## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય


હવાની આવન-જવન હોય એવી જગ્યાએ રંધો.

ખુલ્લામાં ના રંધવું હોય તો હવા માટે બારી કે બારણાં હોય એવો ઓરડો પસંદ કરો. જેથી પવન આવે અને ઘૂમાડો બહાર જય.


જે તમારા ઘરમાં એકથી વધુ સ્ત્રીઓ રહેતી હોય તો અન્ય સ્ત્રીઓ સાથે રંધવાના વારા ગોઠવો જેથી દેરેકને ઓછી ઘૂમાડી આવી પડે. ચૂલાનો ઘૂમાડો ઘરની બહાર નીકળી જય તેવી વ્યવસ્થા ગોઠવો.

ઓછા સમયમાં રંધી શકાય એવી રીતો શોધી કાઢો, જેથી બળતણ બચે અને ખોરાક પૂરેપૂરો રંધાય. રંધવાનો કુલ સમય ઓછો થશે તો ઘૂમાડો પણ ઓછો લેવો પડશો. માટે નીચે જણાવેલી રીતો અપનાવશો તો સમય તો બચશે જ સાથે બળતણ પણ ઓછું વપરશે તથા ખોરાક વધુ સ્વાસ્થ્યદાયી બનશે.

બળતણ પૂરું બળે નહીં તેથી ઘૂમાડો થાય. નિર્ધૂમ ચૂલાથી બળતણનો બચાવ થાય અને ખર્ચ પણ ઘટે છે. તેથી નિર્ધૂમ ચૂલાનો ઉપયોગ કરવો જોઈએ.



ખોરાકના નાના  
ટુકડા કરો.



કઠોળ જેવી વસ્તુઓ આગલી રાત્રે પલાણી રાખો.

લાકડાં પલણે નહીં એવી જગ્યાએ રાખો.


બળતણની આગને પવન ના લાગે એવી રીતે  
તેની આસપાસ માટી, ધોટો કે પત્થર ટાંકો.

ખાવાનું બાફ્ફા માટે કૂકરનો ઉપયોગ  
કરવાથી બળતણ અને સમય બચે છે.

નિર્ધૂમ ચૂલો વાપરો. આવા ચૂલા તમારા વિસ્તારમાં ભળતા હશે અથવા પંચાયતમાંથી તેની માહિતી મળી શકે. નિર્ધૂમ ચૂલા તમે જાતે ઘરે પણ બનાવી શકો છો.

ઓછો ઘૂમાડો પેણા કરે તેવું બળતણ વાપરો.

જે કમશા: નીચે પ્રમાણે છે.



પારંપરિક રીતે લાકડા વાપરવા માટે ચૂલાના વિવિધ પ્રકાર હોય છે. તે માટે નાના-મોટા ચૂલા બેનો જીતે જ માટી અને અન્ય સાધનોનો ઉપયોગ કરીને બનાવી લે છે. છતાં આપણે ત્યાં ખેતીવાડી ખાતું, ઉર્જ વિકાસ સંસ્થા, કેટલાક અન્ય વ્યક્તિઓએ ઘણું કામ કરેલ છે. તે અંગે માહિતી મેળવી શકાય છે. અહીં અમે લાકડાના બળતણથી બનતા એક પ્રકારના નિર્ધૂમ ચૂલા બનાવવાની રીત આપીએ છીએ.

કોલસા બાળવા માટે જૂના ડબ્બા કે ડોલોનો ઉપયોગ કરી બેનો સગડી પણ બનાવે છે. લોખંડની સગડી બજારમાં તૈયાર પણ મળે છે. તદ્વપરાંત વિવિધ પ્રકારના સ્ટવ મળે છે જે મુખ્યત્વે કેરોસીનનો ઉપયોગ કરે છે. તમારી જરૂરિયાત પ્રમાણે તમે વાટવાળા મૂંગા સ્ટવ કે મોટિયાવાળા પ્રાયમસ સ્ટવનો ઉપયોગ કરી શકો છો. પ્રાયમસ સ્ટવનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તેના બર્નરનું કાણું પીનથી બરાબર સાફ રાખો. ઘણીવાર તેની ઉપર કેરોસીનની મેશ કે અન્ય કચરો લાગવાથી તે બંધ થઈ જય છે. તેની અંદર જરૂર કરતા વધુ હવા પમ્પ ના કરવી. તેમ કરવાથી બળતણની ટાંકી ઘડકા સાથે ફાટવાની સંભાવના છે. તેનાથી આગ લાગે, ખરાબ રીતે નજીક કામ કરતા વ્યક્તિઓ રમતા બાળકો, વગેરેને દાજવાનું કે જન-માતનું નુકસાન પણ થઈ શકે છે.



આજ-કાલ શહેરમાં કે નજીકના વિસ્તારોમાં બેનો ગેસ સિલીન્ડર કે ગેસ પાઇપલાઇનથી રંધે છે. આ બાબત પણ જે ચૂલો અને તેના જોડાણોનો ઉપયોગ કરો તે બધા મજબૂત અને પ્રમાણિત હોવા જોઈએ. જેથી અક્સમાતની સંભાવના ધે છે. ગેસ સિલીન્ડરથી ચૂલો ત્રણેક ફૂટ દૂર રાખવો જોઈએ. જેથી કોઈવાર લીકેજના સમયે આગ લાગવાનો ભય ઓછો થાય છે.



## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

ગેસથી રસોઈ કરતી બેનોએ ખાસ યાદ રાખવું જોઈએ કે ધરના બારીબારણા બરાબર ખુલ્લા રાખીને કામ કરવું. બહાર જતી વખતે ગેસનો ચૂલો અને રેઝ્યુલેટર પરનો કોક બરાબર બંધ કરવો. તહેવારના દિવસોમાં ફિટાકડા અને અન્ય પ્રકારની ભયજનક વસ્તુઓ તેની નજીક લાવીને સળગાવવી નહિ. કામ પતી જય ત્યારે કાળજીપૂર્વક ચૂલાનો વાલ્વ બંધ કરી દેવો જોઈએ.

### ૨.૦ વજનદાર વસ્તુઓ ઉંચકવી અને લઈ જવી.

પાણી ભરવું, લાકડાં લાવવાં, બાળકોને ઉંચકવા વગેરે રોજ-બરોજના કામમાં ભારે વજન ઉંચકવાથી સ્ત્રીઓને પીઠ અને ગરદનમાં દુઃખાવો થાય છે.

નાની છોકરીઓ ભારે વજન ઉંચકે-ખાસ કરીને પાણી-તો આગળ જતાં તેમને પીઠમાં કે કરોડના હાડકામાં તકલીફ થાય છે. પેઢાના હાડકાનો વિકાસ ઓછો થાય છે અને પછીથી પ્રસૂતિ વખતે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. વજન ઉંચકવાથી કસુવાવડ પણ થઈ શકે. ઘરડી સ્ત્રીઓ કે તાજેતરમાં માતા બનેતી સ્ત્રીઓને ગર્ભાશય અસવાની તકલીફ થાય છે.

નુકશાન અટકાવવું :

ઉંચકવાની સલામત રીત :

- \* વજન ઉંચકતી વખતે પીઠના સ્નાયુઓને બદલે પગના સ્નાયુઓનો ઉપયોગ કરો. વસ્તુ કે બાળકને જમીન પરથી ઉંચકતી વખતે કમરથી આગળ નીચા નમવાને બદલે ધૂટણથી જૂંકીને ઉંચકો.
- \* પીઠ, ખભા અને ગરદન ટણાર રાખો.
- \* સગર્ભા હો ત્યારે કે બાળકના જન્મ પછી તરત વજનદાર વસ્તુઓ ઉંચકશો નહીં.
- \* ભારે વજન ઉંચકવામાં કોઇકની મહદુદ લો. શરૂઆતમાં, કોઇને બોલાવવામાં વધારે સમય જતો હોય તેમ લાગશે, પણ લાંબે ગાળે કમરની તકલીફો થાય ત્યારે બગડતા સમય કરતાં આ વધુ સારુ છે એ ઘ્યાલમાં રાખો.

વજન લઈ જવાની સલામત રીત :

- \* ઉંચકેલી વસ્તુ શરીરની નજીક રાખો.



પીઠની સમસ્યાઓ મટાડવા કરતાં ઉલ્લિ થતી રોકવી સહેલી છે. શક્ય હોય ત્યાં પીઠ કરતાં પગનો ઉપયોગ કરો.

## વજનદાર વસ્તુઓ ઉંચકવી અને લઈ જવી.

- \* બોળો પીઠ પર લેવાથી શરીરની એક બાજુના સ્નાયુઓ પર દ્વારા ઓછું આવે છે. શરીરની એક તરફ ઉંચકવાથી કરોડ વળી જય છે અને પીઠને ઈજ થાય છે.
- \* વસ્તુ એક જ બાજુ ઉંચકવી પડે એમ હોય તો વારા ફરતી બંન્ધે બાજુ પર ઉંચકો, જેથી બંન્ધે બાજુના સ્નાયુઓ વપરાશે અને કરોડ બંન્ધે બાજુ વળશે. એ અશક્ય હોય તો એક બાજુ વધારે વજન ઉંચકવાને બદલે બે ભાગ કરી બંને બાજુ અહંકુર અહંકુર ઉંચકો.
- \* માથા પર પણી બાંધી તેનાથી પીઠ પરનું વજન ઉંચકશો નહીં. એ ગરદનના સ્નાયુઓને નુકશાન પહોંચાડે છે.



જે તમને પીઠની સમસ્યાઓ હોય જ તો :

- \* ધૂંટણ નીચે ઓશિકું કે કપડાંના વીઠો રાખીને પીઠ પર છતા સૂઈ જવ. અથવા પાસાબેર સૂલું હોય તો કપડાંનો એક વીઠો પીઠની પાછળ અને બીજો ધૂંટણની વચ્ચે રાખીને સુઓ જેથી તમારું શરીર સીધું રહે અને કરોડને ટેકો મળો.
- \* પીઠના અને પેઢના સ્નાયુઓને મજબૂત કરવા કસરત કરો (બાજુના પાન પર બતાવ્યા મુજબ) જે દુઃખાવો થાય તો કસરત બંધ કરો.
- \* દિવસ દરમ્યાન પીઠ બને એટલી સીધી રાખો. આગળથી નીચા નમશો નહીં.



જમીન પરની વસ્તુને પહોંચવા કમર આગળથી નીચા નમશો નહીં.

એના બદલે ધૂંટણ વાળીને પીઠને દાદાર રાખીને ઉલા પગે બેસો.

**ના**



ધોતી વખતે, ખેતીમાં કે પરચુરણ કામ કરતી વખતે ખીઓ સામાન્ય રીતે કરે છે એમ લાંબા સમય સુધી આગળથી વળેલા રહેવાથી પીઠનો દુઃખાવો થાય છે. જે નીચા વળવું જરૂરી જ હોય તો થોડી થોડી વારે સ્થિતિ બદલો.

**હા**



## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

પીઠ અને પેટના સ્નાયુઓને મજબૂત અને લયકદાર બનાવવાની કસરતો :

નીચે બતાવેલા કમાં જ આ કસરતો દરરોજ કરો.

૧. પીઠને ખેંચવી : છતા સુધી જવ.

બંને ધૂંટણને પેટ તરફ લાવી બંને હાથથી પકડો. ઉડો શાસ લઈને ૧૦-૧૫ સેકન્ડ સુધી આમ રાખો. શાસ મૂકતી વખતે ધૂંટણને છાતી સુધી લાવો જેથી પીઠના સ્નાયુનું ખેંચાણ વધશે.

બે વખત અથવા પીઠમાં સાડું લાગે ત્યાં સુધી આમ કરો.



૨. મરડાવું : બંને હાથફેલાવીને જમીન પર છતા સુધી જવ. ધૂંટણને વાળીને એક તરફ લઈ જવ. અભાને જમીન સાથે અડકાડીને તમારા માથાને વિરદ્ધ દિશામાં ફેરવો. આ સ્થિતિમાં થોડો સમય શાસ

લેવા મૂકવાનું ચાલુ રાખો. પછી ધૂંટણને ધીમેથી વચ્ચે લાવીને બીજી તરફ વાળો. માથું વિરદ્ધ દિશામાં ફેરવો બંને બાજુએ આમ બે-બે વખત કરો.

૩. પેઢાને વાળવું : છતા સુધી જવ. નીચલી પીઠને જમીન સાથે અડકાડી દો. ધીમે ધીમે પેઢું અને થાપાના સ્નાયુઓને સંકોચાયેલા રાખો



અને ત્રણ ગણતાં સુધી આ રીતે પકડી રાખો. શાસ લેવા-મૂકવાનું ચાલુ રાખો. પછી આરામની સ્થિતિમાં આવો. આમ કરો ત્યારે તમારી પીઠ સામાન્ય રીતે હીય છે, એમ વળેલી રહેશે. આ કસરત ફરી ફરી કરો.

### ૩.૦ પાણી સાથેનાં કામ :

#### પાણી સાથે કામ કરવાથી ઉભા થતા પ્રશ્નો :

આખી લિંદગી ભારે વજનના પાણીના વાસણો ઉપાડવાને કારણે સ્ત્રીઓને ગરદન અને કમરના સ્નાયુ કે મણકાની બિમારી થાય છે.



કુટુંબના સ્વાસ્થ્ય માટે જરૂરી હોવા છતાં કેટલીક સમસ્યાઓ ઉભી કરે છે.

લાંબો સમય પાણીમાં કામ કરે છે ત્યારે પાણીમાં રહેલા કે તેની આસપાસના જંતુઓના પ્રદૂષિત સંપર્કથી સ્ત્રીઓના હાથપગના આંગળા ફૂંગાઈ જવા, પગમાં વાઢિયા પડવા, નાના-મોટા ધા જ હદ્દી પાકી જવા, તથા વાળો, લેખ્ટોસ્પાયરોસીસ જેવા અન્ય પાણી જન્ય રોગની ભોગ તે બની શકે છે.

ઉપરવાસના કારખાનાં કે મોટા ઐતરોમાંથી પાણી સાથે આવતાં રસાયણો માનવશરીરમાં જવાથી કે અન્ય રીતે આવા પાણી વાપરનાર લોકોને તેની આડઅસર થયા વગર રહેતી નથી. જે તમે કોઈ કારખાનાના રંગ-રસાયણો છોડાતા હોય તેવા પાણીમાં કામ કરતા હો, તો તમે બધી સ્ત્રીઓ સંગઠિત થઈને આ પ્રદૂષણ વિશે વધુ માહિતી મેળવો અને તેનાથી બચવાના ઉપાયો અંગે વિચાર કરો.





પાણીની સમસ્યા જીના જીવનનું અભિન્ન પાસું છે. છતાં પાણીની વ્યવસ્થા કરવાની હોય ત્યારે જીઓનો અભિપ્રાય લેવામાં આવતો નથી. જીઓએ વિશેષ રસ લઈ પાણીની યોજનાઓ અને વિવિધ સગવડ ઉભી કરવા માટે પોતાનો સહભાગ વધારવો જેઠાંએ. વળી નળ ક્યાં મૂકવા, કુવા ક્યાં ખોહવા, પાણી બચાવવા અને સંઘરસાની વિવિધ યોજનાઓ કરવા બાબતે જીઓની ભાગીદારી વધે તો જ જીઓ પોતાની સમસ્યાઓનો સચોટ ઉકેલ લાવી શકે. વળી, બોરવેલ કે હેંડપ્રે મૂકવા, રીપેર કરવા વગેરે કામોમાં પણ જીઓને તાલીમ મળે તો જીઓ પણ આ કામો કરી શકે છે. માટે તમારા વિસ્તારમાં પાણી અંગેની યોજના બનાવી તે મુજબ કામ કરવાથી ધાણી બેનોને લાભ થશે.

#### ૪.૦ રસાયણો સાથે કામ



રસાયણો સાથેનો  
બિનજરી સંપર્ક ટાળો.

ધણી જીઓને તેમની જાણ બહાર જેખમી રસાયણો સાથે કામ પડે છે. રોજબરોજ વપરાતી વસ્તુઓ અને નોકરી કરતાં હોય ત્યાં પણ રસાયણો છૂપાયેલાં હોય છે. કેટલાક તો ઝૂબ નુકશાનકારક હોય છે. જેમ કે :


- \* જંતુનાશક દ્વારા, રસાયણિક ખાતર, પ્રાણીઓ માટે વપરાતી દ્વારા વગેરે
- \* રંગ, રંગમાં મેળવવાના, રંગ ઓગાળવાના, રંગ કાઢવાના પદાર્થો, વગેરે

- \* બળતણ તેમજ ચીનાઈ માટીના વાસણોના ચળકાટ માટે વપરાતું રસાયણ જેમાં સીસું હોય છે.
- \* ધોવા માટે વપરાતાં બ્લીચ અને અન્ય ક્ષારવાળાં પાણી
- \* વાળની સંભાળ માટેના પદાર્થો-શેખ્ફુ, વાળના રંગ વગેરે



સતત પાણી સાથે કામ કરવાથી અને ડીટર્જન્ટ જેવા રસાયણોવાળા સાખુમાં લાંબો સમય કામ કરવાથી બેનોના આંગળા ફુગાઈ જવા, કહોવાઈ જવા, પાકી જવા, વગેરે તકલીફો થઈ શકે છે.

સ્વાસ્થ્યના પ્રશ્નો :



## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

---

કેટલાંક રસાયણો તમારા શરીરને તાત્કાલિક નુકશાન પહોંચાડે છે. જ્યારે બીજ કેટલાંકનું નુકશાન પાછળથી દેખાય છે. કેટલીકવાર અમુક વસ્તુઓ વાપરવાની બંધ કરો તો પણ નુકશાન ચાલુ રહે છે. કેટલુંક નુકશાન થોડો વખત રહે છે. કેટલુંક કાયમી હોય છે.

શરીર પર રસાયણની અસરો :



રસાયણોથી થતું નુકશાન અટકાવવું : રસાયણોના આરોગ્ય વિષયક જ્ઞેખમો ઓછા કરવા અથવા અટકાવવા માટે આટલું કરો :

- \* રસાયણો ચામડીને સ્પર્શો નહીં એની કાળજી લો. ધરમાં તે વાપરતી વખતે હાથપર પ્લાસ્ટીકની થેતી વીંટાળો કે રબરના મોજ પહેરો. ખેતરમાં વાપરતા હો ત્યારે હાથે જડા મોંન અને પગમાં બૂટ પહેરો.
- \* રસાયણો વાપર્યા પછી હાથ બરાબર ધોઈ નાંખો. જે જંતુનાશક જેવાં તીવ્ર રસાયણ વાપરતા હો તો કપડાં પણ બદલી નાખો અને જમતા પહેલાં નાહીં નાંખો. જ્યારે આ કપડાં ધુઅં ત્યારે કપડા કાઢીને તરત પાણીમાં ડુબાડી હો. થોડી વાર પછી પાણી કાઢી નાંખો. તેને સીંધું ખાળ પર રેડી હો. આમ બે ત્રણ વાર કર્યા પછી એને સાબુમાં નાખી ફરોજની જેમ ધુઅં. શક્ય હોય તો હાથે રબરના મોંન પહેરો.
- \* રસાયણના ઘૂમાડા પાસે કામ કરો તો નાક અને મોં પર ડ્રમાલ (માસ્ક) જરૂર બાંધો.
- \* રસાયણોને ખોરાકથી દૂર રાખો. રસાયણોના ખાલી ડબ્બા, પીપ કે શીરશીઓ બરોબર ધોયા પછી પણ અનાજ, પાણી કે ખોરાક ભરવા વાપરશો નહીં. તે દેખીતી રીતે ચોખ્ખાં લાગે તો પણ ખોરાક કે પાણીને ઝેરી બનાવી શકે છે. ખાવાની વસ્તુઓની નજીક દ્વારાઓના છંટકાવ વખતે પવન દ્વારા દ્વારાઓના છાંટા દૂર સુધી ફેલાય છે તેથી પવનની દિશાનું ધ્યાન રાખો. દ્વારાઓનો છંટકાવ કરો ત્યારે ખોરાક ફંકી રાખો અથવા બીજે મૂકો.
- \* જે રસાયણ આંખમાં પડે તો તરત જ ખૂબ પાણી છાંટીને ધોઈ નાખો. લગભગ ૩૦ વાર ખૂબ પાણીથી આંખને ધોઈ નાંખો. એક આંખ ધોઅનું પાણી બીજી આંખમાં ના લાગે તેની કાળજી રાખો આમ છતાં જે આંખ બળે તો ડૉક્ટર પાસે જવ.



**સીસાનું ઝેર :**

ચિનાઈ માટીનાં વાસણો, રંગ, બળતણ અને બેટરીના પાવર જેવી રોજંદા વપરાશની વસ્તુઓમાં સીસું વપરાય છે, જે ઝેરી હોય છે. જ્યારે આવાં વાસણોમાં જમીએ ત્યારે ઝેર પેટમાં જય છે. કેટલીકવાર પવન સાથે સીસાનો જીણો ભૂકો કે સીસાવાળા કેરોસીન કે પેટ્રોલનો ધૂમાડો પણ શ્વાસ મારફતે શરીરમાં જય છે. સીસુ નાનાં બાળકોને વધારે હાનીકારક છે. તેના લીધે ગર્ભસ્થબાળકનો વિકાસ ધીમો થાય, જન્મ વખતનું વજન ઘટે, મગજને કાયમી ઠંજ થાય કે બાળક મૃત્યુ પામે. તેથી સ્વીઓએ સગર્ભાવસ્થા દરમ્યાન સીસા સાથે કામ ન કરવું જેઠાં એ.

જે તમે સીસા સાથે કામ કરતા હો તો તમારા રક્ષણ માટે :

- \* એનો પાવડર હાથ કે મોં પર લાગવા ન દો.
- \* તમારા કામના સ્થળથી બાળકોને દૂર રાખો.
- \* કામ પૂરું થયા પછી હાથબરાબર સાફ કરો. - ધોઈ નાંખો.
- \* જ્યાં સીસાનો પાવડર પડ્યો હોય ત્યાં કચરો વાળણો નહીં પણ પોતું કરો, જેથી પાવડર હવામાં ઉડે નહીં.
- \* ડેલશ્યમ અને લોહતન્વવાળા ખોરાક વધારે લો. આ સીસાને લોહીમાં ભળતાં અટકાવે છે.

**૫.૦ લાંબો સમય બેસી રહેવું અથવા ઉભા રહેવું**


લાંબો સમય ઉભા રહીને કે બેસીને કામ કરતી સ્વીઓને લાંબે ગાળે સ્વાસ્થ્યના પ્રશ્નો થાય છે.

**સ્વાસ્થ્યની સમસ્યાઓ :**



પીઠ અને ગરદનના પ્રશ્નો : લાંબો સમય ગરદન વાળીને જુકીને બેસી રહેવાથી કે એક જ જગ્યા ઉપર ઉભા રહેવાથી પીઠ અને ગરદનના સ્નાયુમાં કાયમી દુઃખાવો થાય છે કે પછી મણકાની તકલીફ થઈ શકે છે. નસો કુલી જાય, પગો સોજ આવે, પગમાં લોહીના.

ગઢા થાય : લાંબો સમય પગ વાળીને બેસી રહેવું કે સતત ઉભા રહેવાનું હોય તે સ્વીઓને પગના નીચેના ભાગ સુધી લોહી ફરતું નથી. પગમાં લોહી ભ્રમણમાં અવરોધ ઉભો થતાં લોહીનો ભરાવો થવાથી આવી તકલીફ થાય છે.




## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

### નુકશાન અટકાવવું :

કામની વચ્ચે રિસેસમાં ઝડપથી ચાલવું, તે જ ઢમમાં આંટા મારવા અથવા દર કલાકે પગ લાંબા ટૂંકા કરવાથી ફાયદો થાય છે.


શક્ય હોય તો ઘૂંટણથી ઉપર સુધીના મોનાં પહેરો

જ્યારે સ્નાયુઓ કડક થઈ જય કે દુઃખે ત્યારે નીચે મુજબ કસરત કરો. ધીમે ધીમે અને શ્વાસ લેતાં લેતાં આ કસરત બે-ત્રણ વખત કરો.



### કામ કરતી વખતે :

- \* સીધી પીઠવાળી ખુરશી વાપરવી, માથુ, ગરહન, ખભા સીધા રહે તેવી રીતે બેસવું, બેઠક પર નીચેના ભાગના આરામ માટે ગાઢી કે કપડાનો વીંટો રાખવો.
- \* બેઠકની ઉંચાઈ તમારી ઉંચાઈને અનુકૂલ હોવી જેઠાંએ. જરૂર પડ્યે પીઠના નીચેના ભાગે કપડાનો વીંટો કે તકિયો રાખો. તેનાથી પીઠને આરામ રહેશે. આ માટે ટેબલ ઉંચુ લાગે તો જરૂર પડે ખુરશીની બેઠક પર ઓશિકું મૂકી-તેની પર બેસો અને ટેબલ નીચું લાગે તો તેને ધીંટ કે લાકડાના ટૂકડા પર ગોડવો.
- \* પલાઠી વાળીને બેસવાનું ટાળવું જેઠાંએ.
- \* ખુબ ચુસ્ત કપડાં પહેરવા નહીં.




## એક જ પ્રકારનું હલનચલન થયા કરે તેવું કામ કરવું.

### ૬.૦ એક જ પ્રકારનું હલનચલન થયા કરે તેવું કામ કરવું.

શરીરના સાંધા પાસે એકથી વધુ હાડકા બેગા થાય છે. હાડકા અને સ્નાયુઓને જેડતી પેશીઓમાં એકનું એક કામ લાંબો સમય કર્યા કરવાથી નુકશાન થાય છે. ખેતી અને કારખાનામાં કામ કરવાથી કંડા અને કોણીની ઈજ સામાન્ય છે. ઘરકામ કરનાર બેનો, ખાણમાં કામ કરતી સ્વીઓ, વગેરે ઘૂંઠણ વાળીને કામ કરે છે તેથી તેમને ઘૂંઠણમાં તકલીફ થાય છે. સતત લખવાનું કામ કરનારને આંગળીઓના સાંધામાં તકલીફ થાય છે. સતત કોમ્પ્યુટર પર કે ટાઇપરાઇટર ઉપર કામ કરવાથી કંડાના સ્નાયુની તકલીફ થાય છે.


**ચિહ્નો :**

- \* વારંવાર ઉપયોગમાં લેવાતા સાંધામાં દુઃખાવો થાય અને ઝણઝણાઈ થાય.
- \* કંડુ કે કોણીમાં સખત દુઃખાવો થાય, વજન ઉંચકવાનું કે અન્ય કામ કરવાનું મુશ્કેલ બને, સાંધાને હલાવવાથી કડકડ અવાજ થાય.



**ઉપયાર :**

- \* જે તે સાંધાને આરામ આપવો.
- \* જે સાંધાનો ઉપયોગ વધારે થતો હોય તેને આરામ આપવા તેના પર પાટો બાંધો. સાંધાની આજુભાજુ પાતળા લાકડા મૂકી તેની પર કપડું વીટીને અનો પાટો બનાવો અને બાંધો જેથી સાંધો સીધો રહે. સાંધો હાલે નહીં તે માટે પાટો થોડો ફીટ બાંધો. પણ લોહી ફરતું બંધ થઈ જય એટલો બધો ફીટ નહીં. આરામ કરતી વખતે કે સૂતી વખતે પણ આ પાટો બાંધેલો જ રાખો.
- \* સાંધો દુઃખે કે સોન્ને આવે તો એસ્પિરીન કે પીડાશામક ગોળીઓ લો. કપડાના ડૂચાથી વરાળીઓ શેક કરવાથી પણ દુઃખાવો/સોન્ને દૂર થશે.
- \* જે ૬ માસ પછી પણ તકલીફ ચાલુ રહે તો ડૉક્ટરને મળો. તેઓ રાહત માટે તેમને બીજુ દવા આપશો કે ઓપરેશનની જરૂર હશે તો તે અંગે સલાહ આપશો.



**નુકશાન અટકવવું :**

- \* કામ કરતાં કરતાં હાથ આમ તેમ ફેરવો. સાંધા પર જેર ઓછું પ્રેર એવી રીતે કામ કરો. હાથ બદલો કરવાથી જે તે સાંધાને આરામ મળે છે.

## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

- \* દર કલાકે સાંધાને દરેક દિશામાં ફેરવવાની કસરત કરો. ખેંચાણથી પેશીઓ અને સ્નાયુઓની શક્તિ વધશો. જો કસરતથી દુઃખાવો થાય તો સાંધાને ખૂબ ધીમેથી ફેરવો.



જો સાંધો લાલ થાય કે ગરમ લાગે તો ચેપ લાગ્યો છે  
એમ જાણવું અને તરત જ ડૉક્ટરને ભળો.



સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતી શ્રીઓના સ્વાસ્થ્ય અંગે વિશેષ કામગીરી કરવાની જરૂર છે.  
આ માટે વિવિધ સ્તરે હિમાયતના કામો ચલાવવા વધુને વધુ લોકોએ આગળ આવવું જેઠાએ.

### ૭.૦ ગૃહોદ્યોગ કરતી બહેનો

ઘરમાં ચાલતા નાના મોટા ઉધોગોમાં સામાન્ય રીતે સ્વી એકલી ૪ કામ કરે છે. તેને લીધે થતા રોગ અને તે કેમ રોકી શકાય તેની જણકારી સ્વીઓને ઓછી હોય છે.

ઉધોગ	સમસ્યા	શું કરવું
ચીનાઈ માટીના વાસળા બનાવવાનું કામ	ખાણીઆઓને થાય છે એવા ફેફસાંના રોગ (ફાઇબ્રોસીસ, સીલીકોસીસ, વગેરે)	જે ઓરડામાં કામ કરો છો તેમાં વધારે હવા આવે માટે બારી-બારણાં ખોતી નાખો. વીજણી હોય તો પંખાથી અંદરની હવા ઘરની બહાર કાઢો. તેથી ૨૪કણો બહાર જતા રહેશે અને ઘરની અંદર હવા ચોખ્ખી રહે. મોં પર ડમાલ બાંધવાથી તમારા શાસમાં ૨૪કણો નહિ જય.
ચીનાઈ માટી પર પેઠનીંગ (રંગ કામ)	સીસાનું ઝેર	તમે જે રંગ વાપરો છો તે રંગ કોઈ પણ રીતે તમારા ઓરડાક કે પાણી સાથે ભળીને શરીરમાં ના જય તે માટે બધું ૪ કરો. હાથ પર મોંન પહેરીને કામ કરવું તે એક સારો રસ્તો છે.
સિલાઈ, ભરત, ગૂંથણા, વણાઈ, લેસ મૂકવાનું	આંખને કષ પડે, માથાનો દુઃખાવો, નીચલી પીઠ અને ગરફન દુઃખે, સાંઘાનો દુઃખાવો.	વધારે પ્રકાશનો ઉપયોગ કરો. આંખ પર સીધો પ્રકાશ ના પડે અને જે વસ્તુ પર કામ કરો છો તેની ઉપર પ્રકાશ પડે તેવું આયોજન કરો. વચ્ચે વચ્ચે આરામ કરો. અથવા કસરત કરો.
ઉન અને સુતરાઉ કાપડ	દુમ અને ફેફસાંના રોગો.	હવાની આવન-જવન વધારો. મોં પર ડમાલ બાંધો. જેથી રેખા ઉડતા હોય તે તમારા શાસમાં ના જય.
રંગ અને રસાયણ	'રસાયણ સાથેનું કામ' જુઓ.	કોઈ પાણ રંગ કે રસાયણ તમારા શરીરમાં ચીદું ના જય તેની કાળજી લેવી શક્ય હોય ત્યાં સુધી મોંન પહેરીને કામ કરવું.
સાખુ બનાવવા	ચામડી તરડાઈ જય, ચાંદા પડે.	રક્ષણ માટે રબરના મોંન પહેરો. ક્ષારવાળા પાણીનો સીધો સંપર્ક ટાળો.

આ ઉપરાંત સ્વીઓ અગરભર્તી, નાસ્તા બનાવવા, પાપડ ઉધોગ, પેકીંગ ઉધોગ, ઘડિયાળ કે ઈલેક્ટ્રોનિક એસેમ્બલીના કામ, જંગલ પેદાશ વીજાવાનું કામ, બીડી કામદાર તરીકે, મીઠાના અગરમાં, વગેરે કામ કરતી જેવા મળે છે. દેસે કામને કારણે શરીર પર થતી વિશેષ અસરો અંગે વિચાર કરીને ઉપાયો કરવા જોઈએ.

## ૮.૦ કામની અસલામત પરિસ્થિતિ

ઘણાં કારખાનાઓમાં કામની પરિસ્થિતિ બરાબર નથી હોતી. કામના સમયે મજૂરો બહાર નીકળી ન શકે તે માટે બારી-બારણાં બંધ રાખે, બહારથી તાળુ મારેલું હોય. તેથી કટોકટીના સમયે પણ તેઓ બહાર નીકળી શકતા નથી. વળી હવા ઉજસ વિનાની જગ્યાઓમાં કામ કરવું પડે.

- \* વિવિધ કિરણો, રંગ-રસાયણોના સંપર્કથી બચવા જેઠિતા બુટ, મોનં, એપ્રન, મૌના ડ્રમાલ(માસ્ક) વગેરે નથી ભળતા.
- \* અસલામત ઓનિરો વડે કામ કરવાથી અકસ્માત થઈ શકે છે.
- \* ખામીવાળુ લાઇટ ફીટિંગ, આગનો ભય, સહેલાઇથી ભડકો થાય એવાં રસાયણો, ગેસ વગેરે સાથે કામ કરવાનું હોય છે.
- \* ચોખ્યું પાણી, સંડાસ કે બાથરૂમ ન હોય, કે આરામ કરવાની જગ્યા ન હોય કે વિરામનો સમય ના રખાતો હોય.

એક ખૂબ જલ્દીતી રાષ્ટ્રીયકૃત બેંકના વરીષ આધિકારી ગીતાબેન કહે છે કે મારી બેંકની કામગીરીના ૧૫ વર્ષ સુધી હું ક્યારેય બેંકમાં પેસાબ કરવા નહોતી જતી. કરણકે મહિલાઓ માટે અલગ વ્યવસ્થા નહોતી. ધીમે ધીમે અમે બેનોએ ભેગા થઈને માંગણી કરી ત્યારે હવે પરિસ્થિતિ બદલાવા માંડી છે.



તમારા કારખાનાનાનું સ્થળ ગરમ હોય તો ખૂબ પાણી પીઓ અને પૂરતા મીઠાવાળો ખોરાક ખાવ. પુરુષો કરતાં શ્રીઓને ગરમીની અસર (લૂ લાગવી કે બેભાન થઈ જવું) જલ્દી થાય છે. સગર્ભા બેનોએ ગરમીને કારણે નિર્જલીકરણ ના થઈ જય તેની કાળજી લેવી. ખાંડ-મીઠાનું સરખત કે પાણી વારંવાર પીવું જેઠાંએ.



ઘણા શ્રી-પુરુષો સાથે કામ કરતા હોય તેવા કારખાના કે કાર્યાલયોમાં શ્રીઓ માટે અલગ સંડાસ તથા ડ્રેસરમની વ્યવસ્થા હોવી જરૂરી છે. આ માટે સામૂહિક માંગ યુનિયન મારફતે પણ મૂકાવી શકાય છે.

શ્રમિકો ભેગા મળીને આગ્રહપૂર્વક રજુઆત ના કરે ત્યાં સુધી કામના સ્થળે વ્યવસ્થાઓ બદલાતી નથી. પણ આ સમસ્યાના ઉક્લ માટે તમે આટલું કરી શકો.

- \* કામ શરૂ કરતા પહેલાં સલામતીનાં પગલાં વિશે જાણકારી મેળવી લો. તમારા જેવું જ કામ કરતી બીજી સ્ત્રીઓ પાસેથી સલાહ લો.
- \* શક્ય હોય ત્યાં સુધી રક્ષણાત્મક પોષાક પહેરો. જેમ કે માથે ટોપી અથવા સ્કાર્ફ, મોં પર ઢમાલ બાંધવો, ખૂબ અવાજ આવતો હોય તો કાનમાં રૂનાંખો મશીન સાથે કામ કરો ત્યારે-ઢીલાં કપડાં ના પહેરશો. લાંબા વાળને બાંધીને ઢંકેલા રાખો.

#### ૬.૦ જાતીય સત્તામણી

સ્ત્રી પર જેની સત્તા કે અધિકાર છે એવા મેનેજર, માલિક કે અન્ય પુરુષો દ્વારા બિન-જરૂરી સ્પર્શ કે અસ્ત્રિલલ ચેન-ચાળા એ જાતીય સત્તામણી કહેવાય. સ્ત્રી મનથી અસ્વસ્થ બને એવી અસ્ત્રિલલ વાતો, બદાયાદાવાળો સ્પર્શ અથવા જાતીય સુખની માંગણી કરવી કે સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ સમાગમ કરવો વિ. નો સમાવેશ જાતીય સત્તામણીમાં થાય છે. સ્ત્રી ગામડામાં ઘેતીકામ કરતી હોય કે શહેરમાં કારખાનામાં કામ કરતી હોય, ગમે ત્યાં તેને આ ભય રહે છે. ધાર્ણિવાર આવું થાય ત્યારે તે સક્રિય વિરોધ કરી શકતી નથી તેના ધણા કારણો છે.



આવી સત્તામણી અટકાવવાનું સ્ત્રી માટે અધરૂં હોય છે કારણ :

- \* નોકરીની ખૂબ જરૂર હોય ત્યારે નોકરીમાંથી કાઢી મૂકવાની તેને બીક લાગે છે.
- \* વડીલો અને મોટા માણસો કહે તેમ કરવું જોઈએ અથવા તેમની આજ્ઞા માનવી જોઈએ એવું તેના ઉછેર અને સંસ્કાર વશ શીખેલી હોય છે.
- \* પુરુષ સગો હોય તો ના પાઠવાથી કે ફરિયાદ કરવાથી તેને ખરાબ લાગવાનો અને સામાજિક બદનામી થવાનો ભય લાગે છે.

સ્ત્રી ગમે તે સંનેગોમાં હોય, જાતીય સત્તામણી ખરાબ છે જ. આપણા દેશમાં તે ગેરકાયદેસર પણ છે. તમને આવી સત્તામણી થાય તો બીજા



## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

કોઈકને વિશ્વાસમાં લઈને વાત કરો જેથી તમને મદદ મળો. બીજી સ્ત્રીઓને પણ વાત કરો. કદાચ કાયદાકીય પગલાં લેવડાવવાનું તમારે માટે શક્ય ન પણ બને છતાં સાથી સ્ત્રીઓને વાત કરવાથી ફિયદો થાય છે. વળી આવે વખતે તેઓ સાવચેતીથી રહીને આવા બનાવો ટાળી શકે છે. તમને તેઓ સામૂહિક રીતે મદદ કરી શકે. કાયદાકીય રીતે જતીય સત્તામણીના કિસ્સામાં પુરુષને શિક્ષા પણ કરાવી શકાય છે.

### જતીય સત્તામણી બંધ કરવા તમે શું કરી શકો :

- \* તમે જ્યાં કામ કરો છો ત્યાં જે પુરુષો લફ્ઝા હોય તેમનો સંપર્ક ના રાખો.
- \* ઉપરી પુરુષ કે પુરુષ સાથી કાર્યકર જેડે એકલાં કયાંય જશો નહીં.
- \* આ અંગેના કાયદાઓની જાણકારી મેળવો.
- \* સત્તામણી થાય ત્યારે તમારો બચાવ કેવી રીતે કરશો તે શીખી લો.

### ૧૦.૦ સ્થળાંતર



યાદ રાખો કે શરૂઆતમાં બધાને એકલવાયુ લાગે છે આ સ્વાભાવિક છે.

ધણી સ્ત્રીઓ કામ માટે ધરથી દૂર બીજ ગામોમાં જય છે. કેટલાક રોજ આવ-જ કરે છે તો બીજ કેટલાક ત્યાં જ રહે છે. આ સ્થળાંતર રહેવાય.

નજીકના મોટા શહેરોમાં અને કારખાનામાં મજૂરી, નોકરી, ધરકામ વગેરે માટે ગામડામાંથી સ્ત્રીઓ શહેરોમાં જય છે. કેટલીકવાર એક શહેરથી બીજ શહેરમાં ભણવા, નોકરી કરવા કે કામની શોધમાં સ્ત્રીઓને બહાર જવું પડે છે. જ્યારે સ્ત્રીઓ પહેલી વખત બહાર જય ત્યારે તેને એકલું લાગે છે. પોતાના કુટુંબ કે મિત્રોનો સાથ છોડીને જવું પડે છે તેથી તે ગભરાય છે.

### નવા સ્થળે આરામથી રહેવાય તે માટે આ થોડાં સૂચનો છે :

- \* નવા સ્થળે કામ કરતી સ્ત્રીઓને મિત્રો બનાવો. આ સ્ત્રીઓ તમને ટેકો આપશો.
- \* રહેવા માટે સત્તામત ઘર શોધો. કેટલીક કંપનીઓ પોતાની હોસ્ટેલ રાખે છે. આમાંની કેટલીક સત્તામત હોય છે જ્યારે બીજી એવી નથી હોતી. કેટલીકવાર આ જગ્યામાં કોઈ સગવડ હોતી

નથી અને ભાડુ પણ વધારે હોય છે. સ્ત્રીની એકલતા અને ઘર શોધવાની ગરજનો ઘણા લોકો ગેરલાબ લે છે. આવા સ્થળો યોગ્ય નથી કારણે ત્યાં સ્ત્રીઓનો પોતાનો કાબુ રહેતો નથી.

ખરેખર તો પોતે જતે સલામત ઘર શોધવું જ સારું છે.  
નીચે એક ઉદાહરણ છે.  
રત્ને એકલાં ઘરે ચાતીને આવવાનું જોખમ ટાળો.



બાંગલાદેશના ટાકા શહેરમાં કાપડની મીલમાં કામ કરતી સ્ત્રીઓ એમના ગંદા વસવાટથી કંટાળી ગઈ, જ્યાં કેટલીકવાર તેમની જતીય સત્તામણી થતી અને તેમની સાથે દુરાચાર પણ. સંચાલનના અનુભવવાળી સ્ત્રીની મદદથી તેઓએ બે હોસ્ટેલ બનાવી. હવે તેઓ પગારમાંથી કેટલાક પૈસા આ હોસ્ટેલને આપે છે. જેના બદલામાં હોસ્ટેલની સ્ત્રી કામદારો તેમને ખાવાનું, વાસણો, ધાબળા, કપડાં અને બીજુ મદદ આપે છે. આ સ્ત્રીઓ સલામત છે અને કારખાનાની નજીક પણ છે. રહેઠાણ તથા ખાવા-પીવાનો મળી તેમનો કુલ ખર્ચ પણ ઓછો આવે છે.



### ૧૧.૦ ભૂલાઈ ગયેલા શ્રમિક બેનો


ઘણી સ્ત્રીઓ પૈસા કમાવા માટે ફરીને વસ્તુ વેચવાનું, ગૃહ ઉદ્યોગમાં કે ઘરકામના કામ કરે છે. આવાં કામોને વૈધિક નોકરી ગણાતી નથી. આમાં કોઈ સલામતી નથી તેથી તેમનું આર્થિક અને નૈતિક શોષણ પણ થાય છે.

**ઘરકામના શ્રમિકો :** કોઈના ઘરે વાસણા-કપડાં કે કચરા-પોતા માટે જય ત્યારે નથી તેમના કોઈ અધિકારો હોતા કે નથી હોતી કોઈ સલામતી.

\* ખૂબ વૈતરાથી થાકી જય અને ઓછા વેતનના કારણે પૌણિક ખોરાક પણ લઈ શકે નહીં.

## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય


- \* માલિક કાઢી મૂકશે અથવા એના પર અવિશ્વાસ કરશે એવી બીક રહે છે. ગર્ભાવસ્થા દરમ્યાન નોકરી જતી રહેવાનો ડર રહે છે. આવા ભયથી આ બેનોને માનસિક પ્રશ્નો ઉભા થાય છે.
- \* ધણીવાર બહાર કામ કરવાથી તેના ઘરના જ લોકો તેની પર વહેમાય છે અને તેની સામાજિક સત્તામણી થાય છે.
- \* જે તે નોકરી આપનારના ઘરમાં રહેતી હોય તો તેની સાથે જતીય દુર્વ્યવહાર થાય છે. જે તે આ દુર્વ્યવહારનો વિરોધ કરે તો નોકરી જરૂર તેવા ડરથી તે આ અત્યાચાર સહન કરી લે છે.
- \* લાંબો સમય બેસીને કામ કરવાથી હડકાં અને સ્નાયુઓ ફુઃખે.
- \* રસાયણવાળા પાવડરથી કપડાં-વાસણો ધોવાથી ચામડી અને નખની સમસ્યાઓ ઉભી થાય.
- \* ગજ બહારનો શારીરિક શ્રમ કરવાથી તેનું શરીર જલ્દી ઘસાઈ જય છે અને તે નાની ઉંમરે ઘરડી થઈ ગઈ હોય એવું લાગે છે.



ઘરની બહાર કામ કરતી પરણેલી બેનોને જે તેમના પતિ તથા ઘરના અન્ય લોકો પોતાના ઘરકામની જવાબદારીઓ વહેંચી લે એટલે કે સ્વીને પોતાના ઘરના કામોમાં મદદ આપે તો તે કુટુંબનું જીવન વધુ સુદૃઢ બને છે.

ਕਪਦਾਂ ਧੋਨਾਰ ਸ਼ੀਨਾ ਹਾਥ

હાથના મોનં વગર કામવાળી કાયમ કપડાં ધુએ ત્યારે ઘોવાના પાવડરમાંના રસાયણોને લીધે તેની ચામડી લાલ થઈ જય, હાથમાં ચીરા પડે, અને દુઃખે, હાથપર ઉજરડા પડે, નખ બરડ થઈ જય અને ઉખડી પણ જય.



શ્રી કર્માં :

- \* હાથના રક્ષણા માટે પ્લાસ્ટીક કે રખરના મોન પહેરો.
  - \* હાથ બને એટલા કોરા રાખો અને કામ પુરું થયા પછી હાથે લોશન કે કુંવાર પાઠાનો રસ ચોપડો. નખ જાડા થઈને ઉખડવા માંડે તો ભૂરી દ્વાનો નિયમીત ઉપયોગ કરો.
  - \* કામ કરતી વખતે, બાજુમાં તગારામાં ઠંડી કાળી ચા અથવા સરકાવાળું પાણી રાખો. જ્યારે જ્યારે સાબુવાળા હાથ નવરા થાય ત્યારે આ પાણીમાં એક મિનિટ હાથબોળો.
  - \* ફોદ્ધીઓ થાય, ખૂબજલી થાય, ચાંદા પડે એવું કંઈ થાય તો લીમડાના પાનનો રસ ચોપડો. તાજ પાંદડા લઈને ધોઈને તેની લુગદી બનાવો. આ લુગદીમાં તમારા હાથમૂકી રાખો.



## १३.० परिवर्तन भाषे प्रयास

દક્ષિણ આફ્રિકાના ધરકામ કામદારોના સંઘ જેવા મંડળો, અધિકારોના રક્ષણ માટે ખૂબ સારાં છે. પણ સ્થાનિક મંડળ ઉલ્લુ કરવાનું મુશ્કેલ છે કેમ કે આવાં મંડળોને મોટા સંઘોનો સહારો નથી હોતો અને કેટલીકવાર કામ આપનાર માલિકો આ મંજૂરી આપતા નથી. તેથી બીજ ઉપાયો વિચારી શકાય.

દક્ષિણ આફ્રિકામાં ઘરધાટીઓનું મંડળ છે. જે એમના રક્ષણાના કાયદાઓ માટે લડે છે. ધેર ધેર ફરીને ચોપાનીઆ કે રેડીઆ દ્વારા જહેરાતો કરીને લોકોને શિક્ષિત કરવાની શરૂઆત કરી. હવે તેમનું રાષ્ટ્રીય મંડળ થયું છે. બિજલ દેશોનાં આવાં મંડળો સાથે રહીને કામના કલાકો, વ્યાજબી પગાર, સામાજિક સુરક્ષાના લાભો અને અન્ય રક્ષણો માટે તે પ્રયત્નો કરે છે.

## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

જ્યારે શ્રીઓ સંઘર્ષકિત ઉભી કરવા કામના સ્થળે જ બેગાં થાય તો માલિકને ખબર પડે અને નોકરીમાંથી છૂટા કરે. તેથી પોતાના ફળિયામાં કે ઘરોમાં મળવાનું સલામત છે. નીચેના મુદ્દાઓ વિચારી શકાય :

સાથે કામ કરતી બહેનોને મળીને બધાના સર્વસામાન્ય પ્રશ્નો અને તેના ઉકેલો શોધી શકાય.

વિશ્વાસ ઉભો કરવા અને એક-બીજાને ઉપયોગી થવા અવાર-નવાર બેઠકો ગોઠવો. કામમાં નવી જેડાયેલી બહેનોને તમારા જૂથમાં સામેલ કરો અને તેમને હુંક આપો. જેટલી સંખ્યા વધશે એટલું તમારું બળ વધશે. કામદારોના મંડળ કે જૂથતરીકિ તમે વ્યવસ્થિત થશો પછી તમારો જુસ્સો વધશે અને તમે બીજા સંઘના સભ્ય બની શકશો અથવા તમારો સંઘ ઉભો કરી શકશો. કામના સ્થળે તમારી પરિસ્થિતિ સુધારવા માટે મજબૂત સંઘ એક ઉપયોગી માધ્યમ છે. આપણા દેશમાં સંઘ બનાવવો (યુનિયન કરવું) એ કાયદાની દ્રષ્ટિએ દુરેક કામદારનો હક્ક છે. સમય આવે ત્યારે યુનિયન તમારે માટે લડી શકે છે તેથી યુનિયનને મજબૂત બનાવવા પ્રયત્ન કરો. વળી યુનિયન રચનાત્મક રીતે તમારા હક્કોનું રક્ષણ કરી શકે તે માટે નવા નવા રસ્તા શોધો. યુનિયન થકી અન્ય કામદાર કલ્યાણ યોજનાઓ પાણ હાથમાં લઈ શકાય છે.

સલામતી માટે એકબીજાને શીખવો.

કામ કેવી રીતે સરળ અને સલામત બને તે અનુભવી બહેનો પાસેથી શીખો.

નવી બહેનોને મદદ કરો : માલિકો જે તમારી પ્રવૃત્તિની વિક્રિ હશે તો નવી કામે જેડાયેલી બહેનો તમારી સાથે જેડાતાં ખચકાશો. આમ છતાં સલામતી માટે તમારા વિચારો એમને જણાવો.

એકબીજાને સહારો આપો : શ્રીઓ જ્યારે બહાર કામ કરવા જય છે ત્યારે ઘરમાં ઘર્ષણો ઉભાં થાય છે. કેમ કે ઘરમાં તેમની ભૂમિકા બદલાય છે.



મેં આ નોકરી શરૂ કરી  
ત્યારથી મારી પીઠ  
વધારે દુઃખે છે.

એક સાથે ફક્ત  
ત્રણ બંડલ ઉપાડું  
છું તો મારી પીઠ  
દુઃખતી નથી.



આવા કૌટુભિક પ્રશ્નો ઉક્લવા સલાહની આપ-લે કરો. નોકરી અને ધરકામ અથવા બાળ ઉછેર એ બધાંનું સંતુલન કેવી રીતે સાધી શકાય એ અંગે ચર્ચા કરો અને સલાહ લો. કેટલીક બહેનો ઘોડીયાધર ઉભાં કરે છે અથવા એકબીજનાં બાળકોને સાચવે છે. બાળસંભાળ કેન્દ્રમાં એક બેનને નોકરીએ રાખીને બાળકોને સાચવવાનો પ્રશ્ન ઉક્લી શકાય. તમારા કામના બોજ માટે ચર્ચા કરવા તમે પુરુષો સાથે બેઠક ગોઠવી શકો.




ભારતમાં ‘ચેતના’ નામની સંસ્થાની એક કાર્યશાળામાં સ્ત્રીઓ અને પુરુષોએ પોતપોતાનાં કામોની યાદી બનાવી. ધણાને એ જાણીને નવાઈ લાગી કે સ્ત્રીઓનો દિવસ કેટલો વહેલો ઉગે છે અને કેટલો મોડો આથમે છે અને વચ્ચે આરામને ક્યાંય સ્થાન નથી. સ્ત્રી-પુરુષ વચ્ચે કામની અસમાન વહેંચણીનો પણ ખ્યાલ આવ્યો. પછી આ કાર્યભારની સમાન વહેંચણી માટે ચર્ચા શરૂ થઈ જેમાં કામની વહેંચણી માત્ર જતિના આધારે નહીં પણ જરૂર મુજબ થવી જેઠાં એમ નક્કી થયું.

તમારા માલિક સાથે તમે તમારા કામની પરિસ્થિતિ સુધારવા સામૂહિક રજૂઆત અને વાટાધાટો કરો જેમ કે,

- \* કામ વખતે બાળકની સંભાળ
- \* સ્તનપાન માટે ખાનગી જગ્યા
- \* પ્રસુતિની રજાઓ. (રજા બાદ એ જ નોકરી પર પાછા આવવાનો અધિકાર)
- \* સ્ત્રીઓ માટે અલગ બાથરૂમ
- \* સમાન કામ માટે સમાન વેતન

ગુજરાત રાજ્યમાં સેવા સંસ્થા :



અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા બેનોના યુનિયન તરીકે પંકાયેલું યુનિયન (સંગઠન) અમદાવાદમાં અને તેની આસપાસના જિલ્લાઓમાં કાર્યરત છે. તેઓએ શરૂઆત કરી હતી ત્યારે કાપડની મિલોમાં કામ કરતા ભજૂરોના સંગઠનમાં સ્ત્રીલક્ષી નીતિઓનો અભાવ હતો. તેમણે કાપડમિલોમાં કામ કરતી બેનોનું સંગઠન તો કર્યું જ, પણ સાથે સાથે બીજ ક્ષેત્રોમાં પણ અસંગઠિત સ્ત્રીઓને સંગઠનમાં બાંધી. તેથી સ્ત્રીઓને અને સ્ત્રીલક્ષી પ્રશ્નોને મહત્વ મળ્યું.

## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય


તેઓ માને છે કે ગરીબી નસીબની વાત નથી. જ્યારે જ્યારે વધુ સંસાધનવાળા ઘનિકો બીજલનું શોષણ કરે છે અને કામદારોની ગરીબીનો લાભ ઉઠાવી પોતાનું ધન કમાવાના કામમાં જ લાગેલા રહે છે ત્યારે ત્યારે ગરીબી વધે છે. ખાસ કરીને સ્ત્રીઓની બાબતમાં તેઓ એમ સમજે છે કે આર્થિક સજજતા વિના સ્ત્રીઓનું સામાજિક શોષણ પણ ઘટવાનું નથી. તેથી તેઓ સ્ત્રીઓને વધુને વધુ ક્ષેત્રોમાં લાંબા ગાળાના આર્થિક લાભ મળે તે રીતે કામ ગોઠવી રહ્યા છે.

તેઓનું પહેલું પગલું તે ઐતીમાં લાગેલી અગણિત બેનોની સહકારી મંડળીઓ રચવાનું હતું. ત્યાર પછી પોતાની જતે કોઈ પણ ધંધો કે હુન્નર કરતી સ્ત્રીઓની વિવિધ સહકારી મંડળીઓ તેમણે બનાવી છે. આ બધી મંડળીઓમાં સ્ત્રીઓ એકબીજને ટેકો આપે છે. એક મંડળી બીજી મંડળીના પ્રચ્નોમાં મદદ કરે છે.

આ બધું કરવા માટે સેવા સંગઠન દ્વારા ધણા સ્તરના વિવિધ પ્રયત્નો કરવામાં આવ્યા. તેમાંના અગત્યના પ્રક્રોછે :

૧. બેનોને હુન્નર-ધંધો કરવા માટે નાણાં સહાય મેળવી આપવી.
૨. બેનો પોતાની ઉત્પાદિત વસ્તુઓ બજારમાં વેચી શકે તે માટે પ્રયત્નો કરવા.
૩. બેનોને પોતાના કામ માટે જેઠિતો કાચો માલ મેળવવામાં મુશ્કેલી ના પડે. તેમનું શોષણ ના થાય તેવો પ્રયત્ન કરવો.
૪. તમામ કામો કરવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો મેળવી આપવા તાતીમો કરવી.
૫. બેનોની ધંધા પરત્વે તથા સંગઠનલક્ષી વહીવટી તથા અન્ય આવડત વધે તેવી તાતીમ ગોઠવવી.
૬. નવા હુન્નરો શીખવા માટે તાતીમો ગોઠવવી.
૭. આ કામદારોના વિવિધ કામોને સરળ બનાવવા અનુકૂળ નીતિવિષયક પ્રયત્નોના ભાગઢે સરકાર અને ખાનગીક્ષેત્રો સાથે સતત વાટાધાટો કરવી.
૮. સ્ત્રીઓને જીવનની અનેક મુશ્કેલીઓ સામે પાયાની સલામતિ મળી રહે તે માટે વિમાયોજનાઓ પણ તેમણે કરી છે.

આ બધા પ્રયત્નોથી બેનોની આવકમાં વધારો થાય છે. સહકારી મંડળીઓ દ્વારા તેમની સંગઠિત



તાકાત બની છે અને સેવાબેંક દ્વારા તેમને નાણાંકીય સલામતિ પણ મળી છે. સેવાના પ્રયત્નોથી તેઓએ જે વિવિધ મંડળીઓ બનાવી છે તેના ક્ષેત્રો નીચે મુજબ છે :

ઘેરૂત મંડળીઓ, કારીગર મંડળીઓ, મીઠાના અગરિયાની મંડળીઓ, પથ્થર કામદારોની મંડળીઓ, વન-પેદાશ વીણાનાર મંડળીઓ, સેવાકીય આધાર બનનારી મંડળીઓ વગેરેનું આયોજન થયું. તહૃઉપરાંત તેઓએ વિવિધ મંડળીઓને એક તાંતરે બાંધવા માટે ફેરદેશન બનાવ્યું છે. બાળસ્વાસ્થ્ય અને વિકાસના કામો કરતું જૂથ બનાવ્યું છે, બચત ધિરાણ મંડળીઓ કરી છે, મકાન બાંધકામ કામો અંગે ટ્રસ્ટ તથા પ્રકાશન કામો ચલાવવા માટેનું ટ્રસ્ટ બનાવ્યું છે. આમ વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓના હક્કોનું રક્ષણ કરવા અને સ્ત્રીઓને ટેકો આપવા માટેનું સર્વાર્ગીણ આયોજન સેવા સંસ્થા દ્વારા શક્ય બન્યું છે. તેઓ એમ માને છે કે, જ્યારે ગરીબ બેનો ગરીબી હટાવવાની લડત ઉપાડે છે ત્યારે કૌદુર્યિક, સામાજિક અને રાષ્ટ્રીય સમૃદ્ધિ વધે છે.

ગાંધીજીએ સ્ત્રીઓના નેતૃત્વમાં શ્રદ્ધા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જ્યારે સ્ત્રીઓ સમાજ-પરિવર્તનના કામોમાં નેતૃત્વ કરશે ત્યારે જ સમાજ બહલાશે.

બેનોની સંસ્થાએ કરેલા એક અભ્યાસના તારણો ધ્યાન કરવા યોગ્ય છે. તેઓએ એમ શોધી કાઢ્યું છે કે, જે સ્ત્રીઓને બાળ-ઉછેર બાબતે બરાબર મદદ મળે છે તે સ્ત્રીઓ પોતાના કુટુંબમાં આર્થિક-સામાજિક યોગદાન વધુ સારી રીતે કરી શકે છે. જેમકે સેવા યુનિયન હેઠળ કામ કરતી બીડી કામદાર બેનોએ બાળકો સાચવવા માટે એક ઘોડિયાધર કર્યું છે. તેમાં એક-બે બહેનોને બધી બેનોના બાળકો સાચવવાનું કામ સોંચ્યું છે. આ બીડી કામદારો હવે નચિંત થઈને પોતાનું આર્થિક કામ વધુ ક્ષમતાથી કરી શકે છે. કારણકે અગાઉ જ્યારે પણ તેમના બાળકો બિમાર હોય કે તેમને સાચવનાર ન હોય ત્યારે તેઓએ ઘરે રહેવું પડતું હતું અને કયાં તો બાળકોને લઈને તમાકુની ખળીમાં કે બીડી ફેકરીમાં જવું પડતું હતું. તેનાથી તેઓ કામમાં બરાબર ધ્યાન નહોતું આપી શકતા તથા બાળકોનું સ્વાસ્થ્ય પણ જેખમમાં મૂકવું પડતું હતું. ઘોડિયાધર હોવાથી તેઓને હવે બાળકોની ચિંતા થતી નથી, ઘોડિયાધરમાં બાળ-આરોગ્યની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે તથા તેમને માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરેનું આયોજન પણ થઈ શક્યું છે, તથી આ સ્ત્રીઓ હવે વધુ ખુશ રહે છે અને તેમનું કૌદુર્યિક જીવન પણ સુધર્યું છે.



### ૧૩.૦ ભારતમાં કામ કરતી સ્ત્રીઓને માટે રક્ષણ આપતા કાયદા

નીચે આપેલા કેટલાક કાયદાઓ અને તેનાથી સ્ત્રીઓને જે રક્ષણ મળી શકે છે તેના મુખ્ય મુદ્રા શ્રી લક્ષ્મી લિંગમે ૧૯૮૮ માં લખેલા એક લેખ પરથી લેવામાં આવ્યા છે. તેમાં ટૂંકાણ માટે કરવામાં આવેલા ભાષાંતર વગેરેને કારણે રહેલ તુટિઓને ક્ષમ્ય ગણવી તથા વધુ ઉપયોગ માટે મૂળ કાયદાઓનો જ સંદર્ભ લેવો યોગ્ય રહેશે. અહીં આ પ્રયત્ન ફક્ત પાયાની માહિતી વધારવા પરત્વેનો છે.

#### ૧) ફેકટરી એકટ, ૧૯૪૮ :

- \* આ કાયદા હેઠળ સ્ત્રીઓ, પુરુષો તથા બાળકો માટે કેટલું વજન ઉપાડવું તે બાબત ઉત્ત્વેખ છે.
- \* જ્યાં આગળ ખોખાં/કાર્ટૂનો ખોલવા માટેનું મશીન ચાલતું હોય ત્યાં સ્ત્રીઓ કે બાળકોને કામે ન લગાવવા.
- \* સ્ત્રીઓને ટ્રાન્સમીશન મશીનરી કે મુવર્સ (નાનાં-મોટાં સામાનની હેરાફેરી માટે કામમાં લેવાતા મશીનો) ના કોઈ પણ બાળો સાફ્ કરવા, તેમાં તેલ નાંખવા કે ગોઠવવા/રીપેર કરવા જેવા કામોમાં લગાવવી નહિ.

#### ૨) એમલોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ (જનરલ) રેઝ્યુલેશન, ૧૯૫૦ :

- \* આ કાયદો કામદાર વીમા યોજના અંગેનો છે.
- \* મેટરનીટી બેનીફીટ (સુવાવડ લાભ) યોજના હેઠળ હવેથી કસુવાવડ કે સગર્ભાવસ્થાથી આવતી બિમારી કે અધૂરા માસે જન્મનું સરીફીકિટ જે તારીખ જણાવે તે તારીખથી જ બેનોને સુવાવડ લાભ મળવાપાત્ર છે.



#### ૩) પ્લાન્ટેશન લેબર એકટ, ૧૯૫૧ :

- \* ઐતિના કામોમાં જ્યાં ધર્ણી બેનોને કામે લેવાય છે તેમને માટે આ કાયદો કેટલીક સગવડો આપે છે તથા આ બેનોને મટીરીયલ્સ બેનીફીટ એકટનો લાભ મળે છે.
- \* કામના સ્થળ નજીક ઠંડુ પીવાનું પાણી મળી રહેવું જોઈએ.
- \* બેનો અને ભાઈઓ માટે અલગ મુતરડી અને સંડાસની વ્યવસ્થા હોવી જોઈએ.
- \* કામદાર અને તેના કુદુંબીજનો માટે તબીબી સગવડ હોવી જોઈએ.

- \* ૫૦ થી વધુ બેનો કામ પર લેવાતી હોય ત્યાં અથવા કામે લીધેલી બેનોના બાળકોની સંખ્યા ૨૦ થી વધુ હોય ત્યારે ઘોડિયાધરની વ્યવસ્થા કરવી જરૂરી છે.
- ૪) માઈન્સ એક્ટ, ૧૯૫૨ : આ કાયદા ખાણમાં કામ કરતી બેનો માટે કહે છે કે,
- \* બેનોના અને તેમના કુટુંબીજનો માટે આરોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
- \* બેનો માટે અલગ સંડાસ-મૂતરડીની વ્યવસ્થા હોવી જોઈએ.
- \* બેનો અને બાળકોને ખાણોના પેટાળમાં/જમીનની અંદર કામ ના આપવું જોઈએ.
- \* બેનોને રાત્રે કામ પર બોલાવી ના શકાય.
- ૫) મેટરનીટી બેનીફીટ એક્ટ, ૧૯૬૧ : આ કાયદા હેઠળ સુવાવડ માટેની વિશેષ સગવડો સૂચવી છે.
- \* કોઈપણ સ્ત્રીએ જે સણંગ ૮૦ દિવસ કામ કર્યું હોય તેને આ કાયદા હેઠળ મળતા સુવાવડ લાભ મળવા જોઈએ.
- \* સુવાવડ કે કસુવાવડના દિવસથી ૬ અઠવાડિયા (દોઢ માસ) ની રજ તેને મળવી જોઈએ.
- \* સ્ત્રી પરણેલી હોય તો ૯ આ લાભ મળે તેવું જરૂરી નથી.
- \* જે કામથી તેની સગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થ શિશુના વિકાસમાં ખલેત પડે એમ હોય અથવા જેનાથી ગર્ભપાત કે કસુવાવડ થઈ જય તેવી શક્યતા હોય તે કામ આ બેનને સુવાવડની તારીખ અગાઉના ૨.૫ માસ દરમિયાન આપવું ન જોઈએ.
- \* દાકતરી પ્રમાણપત્ર આપે તો તેને સુવાવડ લાભ સુવાવડ અગાઉ પણ ચૂકવી શકાય.
- \* જ્યાં પૂર્વ પ્રસૂતિ તપાસ કે પ્રસૂતિ પશ્વાતની કાળજી મફત આપવામાં ના આવતી હોય ત્યાં ડા. ૨૫૦ મેડીકલ બોન્સ તરીકે તેને મળવા જોઈએ.
- \* જે કસુવાવડ થઈ હોય અને સ્ત્રી તેનું પૂરતું દાકતરી પ્રમાણપત્ર રજૂ કરે તો તેને સવેતન રજ દોડ માસ સુધી આપી શકાય.
- \* ધાવણ આપતી સ્ત્રીને સ્તનપાન કરાવવા માટે બીજી સ્ત્રીઓ કરતાં બે વાર વધુ રિસેસ મળી શકે છે.
- \* ઉપર બે નંબર પર જણાવેલા કાયદા હેઠળ જે બેનની નિમણુંક હોય તેમને સુવાવડ લાભ મળવા પાત્ર નથી. પરંતુ જે બેનોને કાયદાની મર્યાદાની બહાર માર્સિક વેતન મળવા પાત્ર છે. તેવા બેનોને સુવાવડ લાભ મળવા યોગ્ય છે.



## શ્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

---

### ૬) માઈન્સ કેશ ઇલ્સ, ૧૯૬૬

- \* જ્યાં આગળ બેનો કામ કરતી હોય ત્યાં ઘોડિયાધરની વ્યવસ્થા હોવી જોઈએ.
- \* એકથી વધુ ખાણવાળા માલિકો ભેગા થઈને પણ ઘોડિયાધરની સામૂહિક વ્યવસ્થા કરી શકે છે.
- \* ઘોડિયાધરના ઓરડા, સાધનો અને સગવડોને ધ્યાનમાં રાખીને A, B, C, D એમ ચાર પ્રકારના ઘોડિયાધરનો ઉલ્લેખ કરેલો છે.
- \* ઘોડિયાધર ચલાવવા માટે તાતીમ લીધેતા વ્યક્તિની નિમણુક કરવી જોઈએ.



### ૭) ધ. બીડી એન્ડ સિગાર વર્કસ એક્ટ, ૧૯૬૬

- \* ધરે કામ કરતા વ્યક્તિઓને પણ કર્મચારી કહેવાશે.
- \* ૫૦ થી વધુ બેનોને કામે રાખેલા હોય તો ઘોડિયાધર હોવું જરૂરી છે.
- \* બેનોને રાતે કામ કરાવી શકાય નહિ.

### ૮) ધ. કોન્ટ્રાક્ટ લેબર એક્ટ, ૧૯૭૦

- \* ન્યૂનતમ પગાર ધારા મુજબ મહેનતાણું ચૂકવવાનું રહેશે.
- \* કામ પર રહેવાની શરતો બીજી કર્મચારીઓ જોવી જ રહેશે.
- \* સવારે ૬ વાગ્યાથી સાંજે ૭ વાગતા સુધીમાં ૮ કલાકથી વધુ કામ લઈ શકાય નહિ. આ નિયમમાં ફક્ત દાયણબેનો કે નસીંગ સ્ટાફને જ અપવાદ્ધપ ગણવા.



### ૯) ઈક્વલ રેમ્પુનરેશન એક્ટ, ૧૯૭૬ : આ નિયમ હેઠળ શ્રીઓ અને પુરુષોને સમાન કામ માટે સમાન વેતન આપવું જરૂરી છે.

- \* કર્મચારી તરીકે નોકરી આપવા માટે શ્રી કે પુરુષને સરખા ગણવામાં આવશે એટલે કે કોઈ રીતનો લેદભાવ રાખવામાં નહીં આવે.
- \* વ્યક્તિને કામગીરી દરમ્યાન પ્રમોશન, તાતીમ અને બદલી વર્ગેરમાં કોઈ જ ભેદભાવ રાખવામાં આવશે નહિ.

૧૦) બીડી વર્કસ વેલ્ફેર ફન્ડ એક્ટ, ૧૯૭૬

- \* આ એક્ટ હેઠળ બીડી કર્મચારી અને તેના કુટુંબીજનો માટે આરોગ્ય કેન્દ્ર/દવાખાનાની વ્યવસ્થા હોવી જરૂરી બને છે.
- \* આ ફેક્ટરીમાં કામ કરતા મહિલા કર્મચારી બાબતોની સલાહકાર સમિતિમાં શ્રીની નિમણુક જરૂરી છે.

૧૧) ધી ઇંટર સ્ટેટ માઈગ્રન્ટ વર્કસ એક્ટ, ૧૯૭૮

- \* સ્થળાંતરિત કર્મચારીઓ/મજૂરો વગેરે માટે એક પાસબુક આપવી જોઈએ જેમાં વ્યક્તિની ઓળખ, તેના કામ કરવાનું સ્થળ અને અન્ય વિગતો તથા તેનો વેતનદર લખેલો હોવો જોઈએ.
- \* શ્રીઓ માટે સંડાસ-બાથર્ડમની સગવડો અલગ હોવી જોઈએ.
- \* શ્રી-પુરુષ સરખો વેતનધારો રાખવો જોઈએ.
- \* આ કામદારોને રહેવાની સગવડ, મફત તબીબી સહાય, રક્ષણાત્મક કપડા, તેને કે તેની સાથે રહેતા સગા-વહાલાઓને અકર્માત થાય તો તે અંગે સરકારમાં માહિતી આપવી.

૧૨) ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ એક્ટ, ૧૯૮૬ (રેઝ્યુલેશન ઓફ એમ્પલોયમેન્ટ એન્ડ કન્ડીશસન્સ ઓફ સર્વિસ)

- \* મકાન બાંધકામમાં કામ કરતા કામદારો માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે.
- \* બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કસ વેલ્ફેર બોર્ડમાં શ્રી સભ્ય હોવા જોઈએ.
- \* સુવાવડ લાભ વેલ્ફેર ફન્ડના બધા લાભાર્થીઓને મળવો જોઈએ.
- \* ૫૦ કરતાં વધુ શ્રીઓ કામે લેવાય ત્યાં ઘોડિયાધર હોવું જરૂરી છે.



## સ્ત્રીઓનું કામ અને સ્વાસ્થ્ય

### સ્ત્રી-પુરુષ દરેક કામમાં ભાગીદાર બને :

કેટલાક પુરુષો એમ માને છે કે “રસોઈકામ, પાણી ભરવું, સફાઈ કરવી, બાળકો સાચવવા વગેરે સ્ત્રીઓના કામ છે. જો લોકો મને આ કામ કરતાં જોશો તો મારી સામે હસશે અને મજાક કરશે કે હું “બાયલો” થઈ ગયો છું એમ કહી મારું અપમાન કરશે.”

તમે અને તમારા પતિ  
આવી માનસિકતામાંથી  
જેટલા વહેલા બહાર નીકળશો  
તેટલા વહેલા સુખી થશો.

કેટલીક સ્ત્રીઓ પણ એમ માને છે કે, “રસોઈ, પાણી, સફાઈ, બાળક સાચવવું, વગેરે મારું કામ છે. પડોશીઓ મારા પતિને આ કામ કરતાં જોશો તો કહેશે કે આ સ્ત્રી કેવી કુવડ કે કામચોર છે કે તેના પતિને આ કામો કરવા પડે છે !”

આવા વિચારો અને સમાજના ભયના કારણે સ્ત્રીઓને માથે કામનો બોજ વદ્ધા જ કરે છે. ઘરના કામો તો છે જ પણ આજની સ્ત્રીને માથે કમાવાનો બોજ પણ વદ્ધો છે તેથી તેને પુરુષ કરતાં ત્રણ થી ચાર ગણું કામ ઉઠાવવું પડે છે. આ પરિસ્થિતિ બદલવી પડશે. એક ગાડીના બે પૈંડા જેમ સરખા હોવા જરૂરી છે. તેવી જ રીતે સ્ત્રી-પુરુષ સમાજમાં અને ઘરમાં દરેક કામ સરખી રીતે વહેંચીને કરશે, તો જ સમાજ પ્રગતિ પામશે.

ડૉ. જયેશ અને ડૉ. છાયાબેન તેમની બે દીકરીઓને ઉછેરે છે. ડૉ. જયેશ સવારથી કામે જાય છે ત્યારે છાયાબેન રસોઈ પૂરી કરી હે છે અને પોતાની કિસનીક ખોલે છે. બપોરે ડૉ. જયેશ અને તેમની દીકરીઓ લગભગ સાથે જ ઘરે આવે છે ત્યારે બાકીની રસોઈ પૂરી કરવી, દીકરીઓને જમાડવી, બદ્ધો ઢાંકોઢૂંબો કરીને ડૉ. જયેશ પાછા કામે ચઢવાની તૈયારી કરે છે ત્યાં જ છાયાબેન કામેથી ઘરે આવે છે. બંને સાથે જમે છે અને ડૉ. જયેશ ઘરના કામો જેવા કે નાની-મોટી ખરીદી કરવી, બેંકના કામો, બીલો ભરવા વગેરે પતાવીને પોતાની કિસનીક પર પહોંચે તે દરમ્યાન છાયાબેન વળી પાછા પોતાના કામે ચઢી જાય છે અને સાંજે ૭.૦૦ વાગે ઘરે આવી દીકરીઓના ભણવા-ગણવા ઇતરપ્રવૃત્તિઓ વગેરેના ખબર લઈ ફરી રસોઈની તૈયારી કરી લે છે. રાત્રે ૮.૦૦ વાગે એટલે આખું કુટુંબ સાથે બેસી જમે છે અને કિલ્લોલ કરે છે.

ડૉ. જયેશ એમ માને છે કે “મારી પતિનિ મારા જેટલું જ કામ કરે છે, પૈસા કમાવવામાં મારી મદદ કરે છે. તો પછી મારે મિત્ર દાવે પણ ઘરનાં દરેક કામમાં ભાગીદાર બનવું જ જોઈએ. જુના જમાનાની પ્રચલિત માન્યતાઓ તોડીને જે આજે સ્ત્રીઓને ભણાવીએ છીએ, બહારના કામોમાં પલોટીએ છીએ, નોકરી ધંધો કરાવીએ છીએ તો પુરુષે પણ માન્યતાઓ તોડીને ઘરના કામોમાં ભાગ લેવો જ જોઈએ.”